

**B.Com. Semester - 6 (CBCS) Examination**  
**March/April - 2019**  
**CORPORATE TAX PLANING - 2 (DSE-1)**

Time: 2:30 Hours

Marks: 70

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 (અ) આવકવેરાનાં કાયદા હેઠળ “કર્મચારીઓના મહેનતાણા” અંગેની સમજૂતી આપો. (08)

(બ) કર્મચારીઓનાં મહેનતાણાનાં સંદર્ભમાં કર આયોજન અને આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (12)

અથવા

પ્રશ્ન-1 (અ) આવકવેરાનાં કાયદા હેઠળ “વિસર્જન સમયે મિલકતોનું વિતરણ” અંગેની સમજૂતી આપો. (08)

(બ) મિલકતોનું વિસર્જન સમયે વિતરણનાં સંદર્ભમાં કર આયોજન અને આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (12)

પ્રશ્ન-2 (અ) આવકવેરાનાં કાયદા હેઠળ “વૈજ્ઞાનિક સંશોધન” અંગેની સમજૂતી આપો. (08)

(બ) વૈજ્ઞાનિક સંશોધનનાં સંદર્ભમાં કર આયોજન તથા આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (12)

અથવા

પ્રશ્ન-2 (અ) આવકવેરા ધારા અન્વયે “વીમા અંગેનાં વળતરની આવક” અંગેની સમજૂતી આપો. (08)

(બ) વીમા અંગેના વળતરની (પ્રાપ્ત) આવકનાં સંદર્ભમાં કર આયોજન તથા આવકવેરાની ગણતરી ઉદાહરણ સહિત સમજાવો. (12)

પ્રશ્ન-3 નોંધ લખો. (કોઇપણ બે) (15)

(1) બિનરહીશનાં સંબંધિત વિશિષ્ટ જોગવાઈઓનો પરિચય.

(2) બેવડા કરવેરામાં રાહત.

(3) ફેરબદલી કિંમતનાં નિયમન માટેની જોગવાઈઓ.

અથવા

પ્રશ્ન-3 નોંધ લખો.

(1) ઉચ્ચતર કક્ષાનાં ચુકાદાઓ (07)

(2) ઉચ્ચતર કક્ષાની કિંમત નીતિની કબૂલાત. (08)

પ્રશ્ન-4 નીચેના સંબંધી આવકવેરાની વિવિધ જોગવાઈઓ જણાવો. (15)

(1) સંપૂર્ણ એકાકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢીનાં ધંધાનું કંપનીમાં રૂપાંતર સંબંધી.

(2) કંપનીનું મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી (LPP) માં રૂપાંતર અંગે.

અથવા

પ્રશ્ન-4 નોંધ લખો. (કોઇપણ બે) (15)

(1) શાસક અને ગૌણ કંપનીઓ વચ્ચે મિલકતોની ફેરબદલી.

(2) સંયોજનનાં સંદર્ભમાં કરવેરાનું આયોજન.

(3) વિલીનીકરણ છૂટું કરવું (Demerger)નાં સંદર્ભમાં કરવેરાનું આયોજન.

(4) કંપનીનાં ચાલું ધંધાનું સંપૂર્ણ કે અંશ:ત જે તે સ્થિતિમાં વેચાણ કરવાની અસરો.

\*\*\*\*\*

**ENGLISH VERSION**

- Que-1 (A) Give explanation of “Employee’s Remuneration under the Income Tax Act. (08)  
(B) Give explanation with examples with reference to “Employee’s Remuneration” Tax planning and computation of Income Tax. (12)

OR

- Que-1 (A) Give explanation of “Distribution of Assets at the time of Liquidation” under the Income Tax Act. (08)  
(B) Give explanation with examples with reference to “Distribution of Assets at the time of Liquidation” Tax planning and computation of tax. (12)
- Que-2 (A) Give explanation of “Scientific Research” under the Income Tax Act. (08)  
(B) Give explanation with examples with reference to “Scientific Research” Tax Planning and Computation of tax. (12)

OR

- Que-2 (A) Give explanation of “Receipt of Insurance compensation” under the Income Tax Law. (08)  
(B) Give explanation with examples with reference to “Receipt of Insurance compensation” Tax planning and computation of Income Tax. (12)
- Que-3 Write Notes on. (Any Two) (15)  
(1) Introduction of special provisions relating to Non-Residents.  
(2) Double Taxation Relief.  
(3) Provisions regulating Transfer pricing.

OR

- Que-3 Write Notes on. (07)  
(1) Advance Rulings. (07)  
(2) Advance Pricing Agreement. (08)
- Que-4 State Various Provisions of Income Tax Act relating to the followings. (15)  
(1) Conversion of sole proprietary concern/partnership firm in to company.  
(2) Conversion of company into limited liabilities partnership. (LPP)

OR

- Que-4 Write Notes on. (Any two) (15)  
(1) Transfer of Assets between Holding and Subsidiary companies.  
(2) Tax Planning with reference to Amalgamation.  
(3) Tax Planning with reference to Demerger.  
(4) Effects of Slump Sale.

\*\*\*\*\*